

# ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

: સુધારા યાદી :

વંચાણે લીધી: (1) આયોગની તા.18.08.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી  
(2) આયોગની તા.04.01.2018ની રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી

1. કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી હસ્તકની ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-1ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 109/2016-17 ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.09.04.2017 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 19 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી આયોગની કચેરી દ્વારા તા.18.08.2017 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર થતા કુલ: 14 ઉમેદવારોની યાદી આયોગની કચેરી દ્વારા તા.04.01.2018 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

2. આયોગની કચેરી દ્વારા તા.04.01.2018 ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી હેઠળની નોંધ: 3 (2) માં બેઠક નંબર.101000032 પરના ઉમેદવારને “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing Standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.” અનુસાર રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવામાં આવેલ છે. જે રદ કરી સદરહુ ઉમેદવાર જાહેરાતની જોગવાઈ મુજબ નિયત પ્રકારનો અનુભવ પણ ધરાવતા ન હોઈ, તા.04.01.2018 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબરની યાદી હેઠળની નોંધ: 3 (2) નીચે મુજબ વંચાણે લેવા સુધારો કરવામાં આવે છે. નીચે દર્શાવેલ બેઠક નંબર (2) “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા નથી તેમજ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.”

**101000032**

**TOTAL: 01**

3. આયોગની કચેરી દ્વારા તા.04.01.2018ના રોજ પ્રસિદ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

Sd/-

સ્થળ: ગાંધીનગર-382010

સંયુક્ત સચિવ

તારીખ: 19.04.2018

ગુજરાત જાહેર સેવા આયોગ